

AGENDA SETTING AND CLOSING THE LOOP: IDEAS

WE CHOOSE TO PLANT THE SEEDS OF **CONTENT** AND **CHARACTER** EVERY TODAY

EXEMPLAR LIST OF IDEAS FOR CLOSING THE LOOP

SR.NO	CTL STRATEGY	DESCRIPTION	IDEAL FOR	VARIATIONS / TIPS
1	ક્ષક શાંત રિકોલ માર્ગદર્શન	<ul style="list-style-type: none"> વિદ્યાર્થીઓ પોતાની આંખો બંદ રાખે છે એન્ડ શિક્ષક તેમને સેશન ના પ્રવાહ માં લઇ જાય છે જેમાં મુખ્ય મુદ્દાઓ અને મુખ્ય પ્રશ્નોનો સમાવેશ થાય છે, આ દરમિયાન વિદ્યાર્થીઓ પોતાની આંખો બંદ રાખી ને શાંતિ થી કલ્પના કરે છે. 	વિસ્તૃત પ્રવાહ / બહુ-ચરણીય પ્રણાલીક સેશન,	.ગેર- સમજૂતી દૂર કરવા ચર્ચા કરવી વિદ્યાર્થીઓ દ્વારા આપેલા રસપ્રદ જવાબોની ચર્ચા, તેમને કઠિન મુદ્દાઓ વિષે વિચારવા કેલવું.
2	પ્રશ્ન પૂછવું	1. શિક્ષક સત્રના સારને ઉજાગર કરવા માટે પસંદ કરેલા પ્રશ્નો પૂછે છે.	બધા સત્રો	<ul style="list-style-type: none"> અચાનક પ્રશ્નોત્તર (Cold Calls) - પૂર્વનિર્ધારિત (Pre-decided)
3	સેશન નું મૂલ્યાંકન –	1. બાળકોને સેશન ઉપર વિચાર કરવો અને કોઈપણ માપદંડ આધારે મૂલ્યાંકન આપવા માટે કહેવું	બધા સત્રો	સ્માઇલી (વિવિધ ભાવનાઓ જેમ કે હસતું મુખ, ઉદાસ મુખ, સીધું મુખ, એટલે કે સરેરાશ મૂલ્યાંકન)
4	સંબંધો ની રચના	: - બાળકોને સેશન ઉપર પુનરાવલોકન કરવા અને આપેલ ઘટકો સાથે સંબંધ રચવા માટે કહેવું),	દિવસના અંતે ક્લોસિંગ ઘ લૂપ કરવું (End-of-Day Closing the Loop	<ul style="list-style-type: none"> માઇન્ડ બોડી હાર્ટ (Mind Body Heart) પાંચ E (Five E's) , એકમ ઘટક (ઉત્સાહ એકમ માટે - સન્માન, આભાર અને ઉત્તમતા)

5	કચુબ બનાવવું	એક કચુબ ફેંકવું જેમાં દરેક મૂખ પર સમાપન સાથે સંબંધિત પ્રશ્નો હોવા જોઈએ. આ વિકલ્પ મુખ્ય સાર અને સમાનતા લાવવા માટે ઉપયોગી છે .	ટીમ આધારિત પ્રશ્નાવલી	• 6 પાસાઓ ની મર્યાદા
6	માઈન્ડ મેપ	એક માઈન્ડ મેપ બનાવવું જેમાં એકમ અથવા માસવાર હેતુ નો સમાવેશ થયો હોય.	ઝંરો પિરિયડ / એકમ સમાપ્તિ	વિલિન્ન પ્રકાર ના માઈન્ડ માપો નું અન્વેષણ કરવું.